



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા ૧૦/૦૭/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં. ૧૧૪૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૭ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી અને ૮૮ લીટર દેશી દારૂ, ૪૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ રિક્ષા અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૭ કેસ કરી, ૨૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૩૫,૧૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં. ૧૧૪૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી. ૧૦૭, ૧૦૯, ૧૧૦, ૧૫૧ મુજબ કુલ ૨૦૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં. ૧૧૫૦/૧૯

કાગડાપીઠ: પવનકુમાર માધવદાસ મોતયાણી (રહે. દુપસળી સોસાયટી તલાવડી હાંસોલ સરદારનગર) એ તા. ૦૯/૦૭/૧૯ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૦૨/૦૯/૨૦૧૫ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન કાગડાપીઠ સફલ-૩ ખાતે આરોપી (૧) વિજુભાઈ સેવકાની (સફલ-૩ સીયા ફેશન ત્રીજો માળ દુકાન નં-બી/૩૪૫ અને હરીઓમ એ.સી. માર્કેટ કાલુપુર) (૨) વિનોદભાઈ સોનીયા (ફેશન તથા કીએશન-૩૨૩ હરીઓમ એ.સી. માર્કેટ પાંચકુવા કાલુપુર) (૩) અનીલભાઈ નારવાણી (માયાફેશન-૩૧૭ રહે-હરીઓમ એ.સી. માર્કેટ પાંચકુવા કાલુપુર) એ ભેગા મળી વેપારી તરીકે ઓળખ આપી, કાપડનો માલ કિંમત રૂપિયા ૯૦,૫૫,૮૭૫/- ખરીદી કરી, આજદીન સુધી કાપડના માલના રૂપિયા નહીં ચુકવી, પવનકુમાર તથા તેમના ભાગીદાર મેહુલભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એ.જાડેજા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં. ૧૧૫૧/૧૯

વસ્ત્રાપુર: ગેમરભાઈ જીવણભાઈ દેસાઈ (ઉ.વ. ૪૫) (રહે. દર્શન એપાર્ટમેન્ટ, શાશ્ત્રીનગર શાકમાર્કેટ પાસે નારણપુરા) એ તા. ૦૯/૦૭/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૦૬/૦૭/૧૯ રાતના ૮/૦૦ થી તા. ૦૯/૦૭/૧૯ સાંજના ૫/૦૦ વાગ્યા દરમિયાન જે.બી.ટાવરના ભોયરામા "વિરાજ ઇન્ફાટ્રેક" નામની ઓફીસમા આવેલ પોતાની "એસ્ટેટ બ્રોકર" ની કેબીનની બાજુમા આવેલ દરવાજાની લોકની જગ્યાની દીવાલ તોડી, અજાણી વ્યક્તિ કેબીનમાં પ્રવેશ કરી, રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- અને ડેલ કંપનીનું કોમ્પ્યુટર કિંમત રૂપિયા ૮,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

રામોલ: ધનેશ છોટાલાલ ત્રિવેદી (ઉ.વ.૫૨) (રહે.નીરાંત એપાર્ટમેંટ, નીરાંત ચાર રસ્તા વસ્ત્રાલ) એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૭/૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૦૯/૦૭/૧૯ સવારના ૬/૩૦ વાગ્યા દરમ્યાન વસ્ત્રાલ નીરાંત ચાર રસ્તા પાસે આવેલ પોતાની “શીવમ પાર્લર” નામની દુકાનના શટરનું લોક તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, કેશ કાઉન્ટર અને ડબ્બામાંથી રોકડ રૂપિયા ૧,૭૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.બી.વાઘેલા ચલાવે છે.

પર્સ ઝુટવી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૧૧૫૨/૧૯

સોલા હોઇકોર્ટ: કૃપાલીબહેન વા/ઓ સંદીપકુમાર ત્રિવેદી (ઉ.વ.૩૬)(રહે.આઈ.સી.બી.સીટી, વિશ્વાસ સીટી સામે, વંદેમાતરમ ગોતા) તા.૦૯/૦૭/૧૯ બપોરના ૧/૧૫ વાગ્યાના સુમારે વંદેમાતરમ ટાઉનશીપ શાન્તી જુનિયર પ્રી-પ્રાઈમરી સકુલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરેનો) કૃપાલીબહેન પાસેના રોકડ રૂપિયા ૧૦,૦૦૦/-, સોનાનો દોરો કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- સાથેનું પર્સ ખેંચી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ કૃપાલીબહેન ત્રિવેદીએ સોલા હોઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

સાપ કરડતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૧૫૩/૧૯

સરખેજ: લલીબહેન વા/ઓ સંજયભાઈ તડવી (ઉ.વ.૨૩)(રહે.સાણંદ સર્કલથી શાંતિપુરા જતા રોડ પર બંધ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છાપરામાં સરખેજ) તા.૨૯/૦૬/૧૯ રાતના સમયે પોતાના રહેણાંકમાં સુતા હતા ત્યારે સાપ કરડી જતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૯/૦૭/૧૯ નારોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી 'એમ' ડીવીઝન નાઓ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૧૫૪/૧૯

વાસણા: પ્રાચીબહેન ડો/ઓ ભોગીલાલ સોલંકી (ઉ.વ.૧૯) (રહે.ગોકુળ શેરી, સોમેશ્વરનગર વાસણા) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૭/૧૯ કલાક ૧૦/૩૫ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુક સાથે યાદર બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી જે.બી.પરમાર ચલાવે છે.

કૃષ્ણનગર: વનિતાબહેન મહેશભાઈ ગજેરા (ઉ.વ.૪૦) (રહે.ધનેવપાર્ક સોસાયટી વિભાગ-૩ મુક્તિધામ એસ્ટેટ સામે નિકોલ રોડ) એ અગમ્ય કારણસર તા.૦૮/૦૭/૧૯ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોડાના સિલીગના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એન.એસ.સાકરીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.